

: ચઉ વિહારના પચ્ચક્રખાણ :

ઘાર્યા પ્રમાણે ચઉવિહં પિ આહારં પચ્ચખામિ,
અસણં, પાણં, ખાઈમં, સાઈમં,
અન્નત્થણાભોગેણં, સહસાગરે
સવ્વસમાહિવત્તિયાગારેણં, અપ્પાણં વોસિરામિ.

: નવકારસી પોરસી વિગેરેના પચ્ચખાણ :

નવકારસી (પોરસી, દોઢ પોરસી, બે પોરસી, ત્રણ
પોરસી) ના પચ્ચખાણ અસણં, પાણં, આઈમં, ખાઈમં,
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
સવ્વસમાહિવત્તિયાગારેણં, અપ્પાણં, વોસિરામિ.

: એકટાણાના પચ્ચક્રખાણ :

એકટાણા ઉપરાંત દુવિહંપિ આહારં પચ્ચક્રખામિ,
અસણં, ખાઈમં, અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, ગુરુઅબ્બુટ્ટાણેણં, આઉટણપસારેણં,
સવ્વસમાહિવત્તિયાગારેણં, અપ્પાણં, વોસિરામિ.
(નોંધ: જો બિયાસણું કરવું હોયતો એકાસણાને સ્થાને બિયાસણં શબ્દ બોલવો.)

: આયંબિલના પચ્ચક્રખાણ :

આયંબિલવિહં તિવિહં, પિ આહારં પચ્ચક્રખામિ,
અસણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસટ્ટેણં,
પુરુચ્ચમકિખએણં, ગુરુઅબ્બુટ્ટાણેણં, ઉકિખત,
વિવેગણં, સવ્વસમાહિવત્તિયાગારેણં,
અપ્પાણં વોસિરામી.
(નોંધ: જો નિવિઆયંબિલ કરવી હોયતો આયંબિલને સ્થાને નિવિ આયંબિલ શબ્દ બોલવો.)

: ઉપવાસના પચ્ચક્રખાણ :

આવતીકાલે સૂર્ય ઉગ્યા સુઘી
(તિવિહારં ચઉવિહારો જે ઉપવાસ કરવાનો હોયતો)
ઉપવાસના પચ્ચક્રખાણ, અસણં, પાણં, ખાઈમં,
સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
સવ્વસમાહિવત્તિયાગારેણં, અપ્પાણં વોસિરામિ.
(તિવિહારો હોયતો પાણં ન બોલવું)

: તિવિહાર ઉપવાસં :

સૂરે ઉગ્ગએ અબ્બત્તટ્ઠં, પચ્ચખાઈ(પચ્ચખામિ), તિવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં,
સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં,
સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણહાર, પોરિસી સાહપોરિસી, સૂરે ઉગ્ગએ, પુરિમહ, અવહ,
મુટ્ઠિસહિઅં, પચ્ચક્રખાઈ(પચ્ચક્રખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્ચન્નકાલેણં,
દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણવા
અલેવેણવા અચ્છેણવા બહુલેવેણવા સસિત્થેણવા અસિત્થેણવા વોસિરઈ(વોસિરામિ)
(ક્ર એ ઉપવાસ માટે છટ્ઠભત્તં ત્રણ માટે અહંભત્તં ચાર માટે દસંભત્તં, પાંચ માટે દ્વાદશભત્તં
આ રીતે પાઠ બોલવો.)
(ક્ર એ કથી વધુ ઉપવાસ વાળાએ બીજા દિવસથી પાણહારનું પચ્ચખાણ લેવામાટે 'પાણહાર
પોરિસીથી વોસરઈ' સુઘી પાઠ બોલવો.)

: આયંબિલ-નિતિ-એકાસણું-બિયાસણં :

ઉગ્ગએ સૂરે, નમુકકારસહિઅં, પોરિસી, સાહપોરિસી, મુટ્ઠિસહિઅં, ચ્ચક્રખાઈ(પચ્ચક્રખામિ), ઉગ્ગએ સૂરે,
ચઉવિહંપિ, આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્ચન્નકાલેણં,
દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં આયંબિલ, નિવિગઈઅં, વિગઈએ
પચ્ચક્રખાઈ(પચ્ચક્રખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહિત્થસંસટ્ટેણં, ઉકિખત-વિવેગણં,
પુરુચ્ચમકિખએણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, એકાસણં બિયાસણં
પચ્ચક્રખાઈ(પચ્ચક્રખામિ) તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
સાગારિઆગારેણં, આઉટણપસારેણં, ગુરુઅબ્બુટ્ટાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં,
સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણવા અલેવેણવા અચ્છેણવા બહુલેવેણવા સસિત્થેણવા અસિત્થેણવા
વોસિરઈ (વોસિરામિ)
(જો બિયાસણાનું પચ્ચક્રખાણ કરવું હોયતો બિયાસણં અને એકાસણાનું પચ્ચક્રખાણ કરવું હોય તો તે માટે એકાસણં પાઠ ભણવો.)

: ચઉવિહાર ઉપવાસ :

સૂરે ઉગ્ગએ અબ્મત્તદ્ઠં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ), ચઉવિહંપિ આહાર, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ)

: દેશાવપ્રાશ્નિક :

દેસાવગાસિયં, ઉવભોગં, પરિભોગં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ)

: મુહિસહિઅં અભિગ્રહ :

મુહિસહિઅં, અભિગ્ગહં પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, (સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ(વોસિરામિ)

: તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પારવાનો પાઠ :

સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસી, સાહપોરિસી, સૂરે ઉગ્ગએ પુરિમહ્, અવહ્ મુદ્દિઠસહિઅં, પચ્ચકખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણ ફાસિઅં, પાલિઅં, સોહિઅં, કિટ્ઠિઅં, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.

: સાંજના પચ્ચકખાણો-પાણહાર :

પાણહાર, દિવસચરિમં, પચ્ચકખાઈ, (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ)

: ચઉવિહાર-તિવિહાર-દુવિહાર :

દિવસચરિમં પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિહંપિ આહારં, તિવિહંપિ આહારં, દુવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ(વોસિરામિ)

: પ્રભાતના પચ્ચકખાણં :

: નમુકકારસહિઅં મુહિસહિઅં :

ઉગ્ગએ સૂરે, નમુકકારસહિઅં મુહિસહિઅં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિહંપિ આહાર, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ) પિચ્ચકખાણ કરનારે પચ્ચકખામિ અને વોસિરામ શબ્દ બોલાવો.)

: પોરિસી-સાહપોરિસી પુરિમહ્-અવહ્ :

ઉગ્ગએ સૂરે, નમુકકારસહિઅં, પોરિસી, સાહપોરિસી, સૂરે ઉગ્ગએ, પુરિમહ્, અવહ્, મુદ્દિઠ સહિઅં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ), ઉગ્ગએ સૂરે, ચઉવિહંપિ, આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્ચન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ(વોસિરામિ)

: કોઈપણ જાતના પચ્ચકખાણ પારવાની વિધિ :

(કરેલા પચ્ચકખાણનું નામ લઈને)

પચ્ચકખાણ કર્યા હતા તે પુરા થતાં પાણું છું., સમ્મંકાએણં, ફાસિયં, પાલિયં, સોહિયં, તિરિયં, કિટ્ઠિયં, આરાહિયં આણાએ, અણુપાલિતા ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડં.

કહી ત્રણ વાર નવકાર ગણવા.